




પુર્ણતા International School
Shree Swaminarayan Gurukul, Zundal

Grade - VI



Gujarati

Specimen

copy

Year- 2022-23

પાઠ - ૬ ભાઈબંધમારોબોલ્યો ,કુહૂ !

અધરા શબ્દો

1. વિચિત્ર
2. ભેદવું
3. ગાભું
4. ચૂંથવું
5. હળવે
6. અવનવું

શબ્દાર્થ

1. વિચિત્ર - નાગમેતેવાદેખાવવાળું
2. ભેદવું - તોડવું
3. ગાભું - કપડું
4. ચૂંથવું - ફેંકીદેવું
5. હળવે - ખુબધીમેથી
6. અવનવું - નવીજાતનું

સાહિત્ય

નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો

૧) બોધરાજનાગજવામાંશુંશુંભરેલુંહોય ?

જ) બોધરાજનાગજવામાંજીવતોદેડકો ,જાતજાતનાઈડાજેવીચિત્રવિચિત્રવસ્તુઓભરેલીહોય .

૨) ભીષ્મનીમાએભીષ્મઅનેતેનામિત્રબોધરાજનેશુંકરવાકહ્યું ?

જ)ભીષ્મનીમાએભીષ્મઅનેતેનામિત્રબોધરાજનેસાથેમળીનેગોદામસાફકરવાકહ્યું ?

૩)ગોદામમાંકોનોમાળોહતો ?

જ)ગોદામમાંકાબરનોમાળોહતો .

૪) ભીષ્મઅનેબોધરાજગોદામમાંથીમાળોક્યાંલઈઆવ્યા ?

જ) ભીષ્મઅનેબોધરાજગોદામમાંથીમાળોગેરેજમાંલઈઆવ્યા .

૫) બીજેદિવસેબોધરાજઆવ્યોત્યારેશુંલઈઆવ્યો ?

જ) બીજેદિવસેબોધરાજઆવ્યોત્યારેદાણાનીથેલીભરીનેલઈઆવ્યો .

નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો

૧) વર્ગ માં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો ?તે શું શું કરતો હતો ?

જ) વર્ગ માં સૌથી વિચિત્ર છોકરો બોધરાજ હતો .તે ગોફણથી નિશાન તાકતો હતો .પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમાં આવી જાય .તેના ગજવામાં જીવતો દેડકો ,જાતજાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરતો .

ર) ભીષ્મા નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો ?

જ) ભીષ્મા નવા બંગલા ની આસપાસ વનરાજી હતી. આથી બોધરાજ ભીષ્મા નવા બંગલે જતો .એને ત્યાંની વનરાજી માં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું .

વ્યાકરણ

નીચેના વિધાની ખરા છે કે ખોટા તે લખો

1. વર્ગ માં ભીષ્મ વિચિત્ર છોકરો હતો . _____
2. ગોદામમાં અંધારું હતું . _____
3. શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો . _____
4. બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય . _____

સાચી શબ્દ જોડણી શોધી લખો

1. સમડી /સમટી - _____
2. પતંગિયું /પતંગીયુ - _____
3. ટોકિયો /ટોકિયું - _____
4. પકાશ/પ્રકાશ - _____
5. નીસાન /નિશાન- _____

પાઠ -૭ ખોટો જાદુ ,ખોટો બાવો ?

અઘરા શબ્દો

1. તક
2. ચટપટી થવી
3. ત્રાટ
4. ગાયબ
5. મતવાલી
6. બાથ ભીડવી
7. આટો
8. સરપાવ
9. જશ

શબ્દાર્થ

1. તક - લાગ
2. ચટપટી થવી - તાલાવેલી થવી
3. ત્રાટક- તાકીને એક સાથે જોવું
4. ગાયબ - ગુમ
5. મતવાલી - મસ્ત

6. બાથ ભીડવી - મોટું કામ હિમત ભેર ઉપાડવું
7. આટો - લોટ
8. સરપાવ- ઇનામ
9. જશ- ગુણ

સાહિત્ય

૧)વર્ગ માં કોને જાદુ રજૂ કર્યા ?

જ) વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા .

૨) તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી ?

જ)તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી .

૩) છરી ઉપર શું લગાવેલું હતું ?

જ)છરી ઉપર કપાસના જિડવાનો રસ લગાવેલા હતા .

૪)તૃપ્તિએ પગ ના તળિયે શાનો લેપ કર્યો ?

જ)તૃપ્તિએ પગ ના તળિયે હળદરનો લેપ કર્યો .

૫) દુપટ્ટા ઉપર શું ચોટેલું હતું ?

જ) દુપટ્ટાપર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો .

૧) તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કર્યા કર્યા જાદુ બતાવ્યા ?

જ) તૃપ્તિ અને અંશુલે વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા

૧) જામફળ ,રબર અને ચાવીને ટેબલ ની એક બજૂથીબીજી બાજુ ખસ્ટા બતાવ્યા

૨) લીબુંને કાપતા તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો .

૩) દુપટ્ટા પર માતાજીના પગલાં -કંકુ પગલાં પસવાનો જાદુ બતાવ્યો .

૨) કમુએ તાળીઓ શા માટે પાડી ?

જ)દુપટ્ટા પર મચુર ,નફીસા અને સાગરે પગલાં પડ્યા .તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી તેથી કમુ એ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ !

વ્યાકરણ

યોગ્ય વિકલ્પ પસંદ કરી કાલી જગ્યા પૂરો

1. _____ ને ટેબલે પરની ખીલી ફસાવી દીધું હતું .(દોરા ,ઇલેસ્ટિક)

2. _____ પર કપાસના જીડવાનો રસ લગાવ્યો . (લીબું, છરી)
3. તૃપ્તિ એ પગના તળિયે _____ નો લેપ કર્યો .(હળદર ,ચુના)
4. _____ પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો . (ચાદર , દુપટ્ટા)
5. _____ શબ્દ સાંભળતા જ્યાં ,મયુર અને ઋતુ ગભરાઈ ગયા .(ડાકણ , માતાજી)

હતા , છે , કે હશે વડે ખાલી જગ્યા પૂરો .

1. અત્યારે રમેશ ક્રિકેટ રમે _____
2. ગઈ કાલે વિદ્યાર્થી વર્ગમાં _____
3. મારા કાકા આવતી કાલે મુંબઈ _____
4. અત્યારે માધવી રસોઈ બનાવે _____

સાચી જોડણી વાળા શબ્દ શોધીને લખો

1. ડોપલી / ટોપલી _____
2. વિધા / વિધ્યા _____
3. સરમ / શરમ _____
4. ચીપિયો / ચિપીયો _____
5. હળદર / હડદર _____
6. પેચીલ / પેન્સીલ _____

પુ . ના .